

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (વિદ્યાર્થીઓમાટે અગત્યની સુચના)

- ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાનપ્રવાહ) ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માં સ્નાતક /ડીપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આ યોજના અન્વયે આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ યોજનાના શિક્ષણ વિભાગના તા. ૦૭/૧૦/૨૦૧૫ અને તા. ૦૪/૦૬/૨૦૧૬ ના ઠરાવમાં જણાવ્યા મુજબની પરસેન્ટાઈલ અને વાલીની આવકની પાત્રતા ધરાવતા અને શૈક્ષણિક વર્ષ-૨૦૧૬-૧૭ માં સ્નાતક/ડીપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ <http://mysy.guj.nic.in> પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં માંગવામાં આવેલ વિગતો વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. **વિદ્યાર્થીએ પોતાનો પ્રવેશ આખરી થાય ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.**
- વિદ્યાર્થીએ વાલીની આવકનું નાંણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ નું આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. નોટરાઈઝ્ડ એફીડેવીટમાં પણ વાલીની (માતા-પિતા) આવકની વિગતો આપવાની રહેશે.
- એફીડેવીટ તથા આવકના પ્રમાણપત્રનું ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
- મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) હેઠળ સીધી જમા થતી હોવાથી વિદ્યાર્થીઓએ નેશનલાઈઝ બેન્કમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેન્ક ખાતા સાથે વિદ્યાર્થીઓએ પોતાના આધાર નંબર જોડવાના (seeding) રહેશે. **વિદ્યાર્થીઓએ પોતાના આધારકાર્ડની વિગતો ઓનલાઈન અરજીમાં આપવાની રહેશે.**
- વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈ નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે નીચે જણાવેલ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
 1. આધારકાર્ડની નકલ
 2. ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પાસ કર્યાની માર્કસીટની નકલ,
 3. ડીગ્રી /ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની નકલ,
 4. ટ્યુશન ફી ભર્યાની પહોંચોની નકલ,
 5. નોટરાઈઝ્ડ એફીડેવીટ (અસલમાં)
 6. વાલીની આવકનું પ્રમાણપત્રની નકલ (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું),
 7. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની નકલ,
 8. નેશનલાઈઝ બેન્કમાં બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ
- આ યોજનાના અમલ માટે રાજ્યભરમાં ૯૧ હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે અને ચકાસણી બાદ અરજી પત્રક અને દસ્તાવેજોનો એક સેટ હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાનો રહેશે. હેલ્પ સેન્ટર ખાતે અરજી જમા કરાવીને **Acknowledgement Slip** મેળવવાની રહેશે.
- **હેલ્પ સેન્ટરોના કો-ઓર્ડિનેટરોની વિગતો વેબસાઈટ પર રાખેલ છે જેઓનો કામકાજના દિવસો અને સમય દરમિયાન જ સંપર્ક કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને ખાસ નમ્ર વિનંતી છે.**

- ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાનપ્રવાહ) ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવનાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી (registration) સંબંધિત કોઈ મુંઝવણ હોય તો તેમણે પોતાની ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ ની માર્કશીટ Scan કરીને .pdf ફાઈલ નીચે જણાવેલ mysygujarat@gmail.com પર મોકલી આપવાની રહેશે.
- આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ **સહાય મંજૂર થવા સંબંધિત તથા ખુટતા દસ્તાવેજોની પુર્તતા સંબંધિત તથા અન્ય કોઈ પણ પ્રકારની જાણકારી માટે અભ્યાસક્રમવાર** નીચે જણાવેલ ઈ-મેલ પર પોતાની Query મોકલી આપવાની રહેશે. જેથી આપની સમસ્યાનું ઝડપથી નિવારણ થઈ શકશે. વિદ્યાર્થીના પ્રશ્નનું નિરાકરણ સંબંધિત કચેરી દ્વારા થતું હોઈ વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમ માટે ફાળવવામાં આવેલ ઈ-મેલ નો જ ઉપયોગ કરે તે આવશ્યક છે.

ક્રમ	સ્નાતક -ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમ	ઈ-મેલ એડ્રેસ
૧	ઈજનેરી ફાર્મસી આર્કિટેકચર	musytechnical@gmail.com
૨	મેડીકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિક ફીઝિયોથેરાપી તથા અન્ય પેરામેડીકલ અભ્યાસક્રમો	musymedical@gmail.com
૩	ઉચ્ચ શિક્ષણના આર્ટ્સ , સાયન્સ, કોમર્સ , બીબીએ, બીસીએ જેવા સંબંધિત અન્ય અભ્યાસક્રમો	musyhigher@gmail.com
૪	એગ્રીકલ્ચર સંબંધિત અભ્યાસક્રમો	saucouncil@gmail.com
૫	વેટરનરી સંબંધિત અભ્યાસક્રમો	hvgoriya@gmail.com

- યોજનાની વધુ માહિતિ હેલ્પ લાઈન નં: ૦૭૯- ૨૬૫૬૬૦૦૦ પરથી મળી શકશે.